

પ્રેસનોટ

૨૦મી એ.આઇ.સી.આર.પી. ઓન નેમાટોડ્સ ઇન એગ્રીકલ્ચરની ટ્રી-વર્ષિય બેઠકનું

આયોજન

કૃમિશાસ્ત્ર વિભાગ, બી.એ.સી.એ., આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને એ.આઇ.સી.આર.પી. ઓન નેમાટોડ્સ ઇન એગ્રીકલ્ચર, આઇ.સી.એ.આર., નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ૨૦મી એ.આઇ.સી.આર.પી. ઓન નેમાટોડ્સ ઇન એગ્રીકલ્ચરની ટ્રી-વર્ષિય બેઠકનું આયોજન યાજ્ઞવલ્કય હોલ, આકૃત્યુ, આણંદ ખાતે કરવામાં આવેલ. આ ત્રણ દિવસીય (તા. ૧૫.૦૨.૨૦૧૮થી ૧૭.૦૨.૨૦૧૮) બેઠકનું ઉદ્ઘાટન તા. ૧૬/૦૨/૨૦૧૮ના રોજ ડૉ. કે. બી. કથીરીયા, માન. સશોધન નિયામકશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથી ડૉ. પી. પી. રેડ્ડી (ભુતપૂર્વ નિયામકશ્રી, આઇ.આઇ.એચ.આર, બેંગલુરુ) અને અતિથી વિશેષશ્રી ડૉ. ડી.જે. પટેલ (ભુતપૂર્વ આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી, બી.એ.સી.એ., આણંદ); ડૉ. રાજન (આઇ.સી.એ.આર, નવી દિલ્હી) તેમજ ડૉ. આર. કે. વાલીયા, યોજના સંયોજક (એ.આઇ.સી.આર.પી. ઓન નેમાટોડ્સ ઇન એગ્રીકલ્ચર, નવી દિલ્હી) હાજર રહેલા. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલ બધા કૃમિશાસ્ત્રીઓનું સ્વાગત ડૉ. કથીરીયાએ કર્યું. ડૉ. વાલીયાએ આ યોજનાનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ઉદ્દેશની ચર્ચા કરી સાથે સાથે ૨૦૧૫ થી ૨૦૧૭ દરમિયાન મેળવેલ મુખ્ય સિદ્ધિઓ વિશે માહિતી આપી તેમજ કૃમિના લીધે નવા ઉભા થયેલા અગત્યના પ્રશ્નો વિષે પણ અવગત કર્યાં.

ડૉ. રેડ્ડીએ કૃમિના નવા ઉભા થયેલ પ્રશ્નો માટે વૈજ્ઞાનીકોને સલાહ આપી તેમજ તેના નિવારણ અંગે પોતના અનુભવો જણાવ્યા જેમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃમિના જૈવિક નિયંત્રણનો ફાળો સમજાવ્યો. ડૉ. પટેલે પણ કૃમિના નિયંત્રણ માટે સોઇલ સોલરાઇઝેશન અને પાકની ફેરબદલી જેવી અસરકારક પદ્ધતીઓ અંગે જાણકારી આપી.

આ પ્રસંગે ડૉ. કથીરીયા અને ડૉ. વાલીયાના હસ્તે એ.આઇ.સી.આર.પી. ઓન નેમાટોડ્સ ઇન એગ્રીકલ્ચરના ટ્રી-વર્ષિય રીપોર્ટ અને વિવિધ રાજ્યોની સ્થાનિક ભાષામાં ખેડૂત ઉપયોગી કૃમિ નિયંત્રણ અંગેની માહિતી પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું.

સદર કાર્યક્રમમાં બે દિવસ ટેકનીકલ ચર્ચા કરવામાં આવી અને ત્રીજા દિવસે ફિલ્ડ વિઝિટ નુ આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના ડૉ.અરૂણ પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ. કે. પી. પટેલ, આચાર્યશ્રી. બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ, કૃષિ યુનિવર્સિટીના વિવિધ મહાનુભાવો તેમજ દેશભરના ૨૩ રાજ્યોના કુલ ૫૬ કૃમિશાસ્ત્રીઓએ ભાગ લીધો. અંતમાં ડૉ. બી. એ. પટેલે (કાર્યક્રમના આયોજક તથા વડા કૃમિશાસ્ત્ર વિભાગ) આભાર વિધિ કરી.